

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

મંડળ દ્વારા વિવિધ તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક: (1) ૧૪૬/૨૦૧૮૧૯- લેબોરેટરી ટેકનીશીયન (2) ૧૪૮/૨૦૧૮૧૯- માઇન્સ સુપરવાઇઝર, (3) ૧૪૯/૨૦૧૮૧૯- ટેકનીકલ આસીસ્ટન્ટ, (4) ૧૫૪/૨૦૧૮૧૯- એગ્રીકલ્ચર ઓવરશીયર, (5) ૧૫૫/૨૦૧૮૧૯ સીનિયર ફાર્માસીસ્ટ (6) ૧૫૭/૨૦૧૮૧૯ ગ્રંથપાલ (7) ૧૫૮/૨૦૧૮૧૯ - ફિઝીયો થેરાપીસ્ટ/ ટ્યુટર કમ ફિઝિયો થેરાપીસ્ટ, વર્ગ-૩ સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૯ તેમજ જાન્યુઆરી-૨૦૨૦ માં જુદી જુદી તારીખોએ યોજવામાં આવેલ હતી. ઉક્ત સ્પર્ધાત્મક લેખિત કસોટીને અંતે જે તે સંવર્ગમાં ભરવાની થતી જગ્યાઓના ત્રણ ગણા ઉમેદવારો (૪૦ % લઘુત્તમ લાયકી ગુણની મર્યાદામાં ઉપલબ્ધ ઉમેદવારો) ને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે લાયક (કવોલીફાય) ગણવામાં આવેલ છે. તેવા ઉમેદવારોની સંવર્ગ-જાહેરાતવાર યાદી નીચે આપેલ લીન્ક ફાઇલ પર મૂકવામાં આવેલ છે. જે સંબંધિત ઉમેદવારોને જોઇ લેવા માટે આથી જણાવવામાં આવે છે.

૧. જા.ક. ૧૪૬/૨૦૧૮૧૯, લેબોરેટરી ટેકનીશીયન (અહીં ક્લિક કરો)

૨. જા.ક. ૧૪૮/૨૦૧૮૧૯, માઇન્સ સુપરવાઇઝર (અહીં ક્લિક કરો)

૩. જા.ક. ૧૪૯/૨૦૧૮૧૯, ટેકનીકલ આસીસ્ટન્ટ (અહીં ક્લિક કરો)

૪. જા.ક. ૧૫૪/૨૦૧૮૧૯, એગ્રીકલ્ચર ઓવરશીયર (અહીં ક્લિક કરો)

૫. જા.ક. ૧૫૫/૨૦૧૮૧૯, સિનિયર ફાર્માસીસ્ટ (અહીં ક્લિક કરો)

૬. જા.ક. ૧૫૭/૨૦૧૮૧૯, ગ્રંથપાલ (અહીં ક્લિક કરો)

૭. જા.ક. ૧૫૮/૨૦૧૮૧૯, ફિઝીયો થેરાપીસ્ટ/ ટ્યુટર કમ ફિઝિયો થેરાપીસ્ટ (અહીં ક્લિક કરો)

(૧) ઉક્ત સંવર્ગોની બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ આગામી ૧૫ મી ઓક્ટોબર-૨૦૨૦ પછી યોજવાનું મંડળ દ્વારા વિચારણા કરવામાં આવેલ છે. જેનો જાહેરાત- સંવર્ગવાર વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.

(૨) કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી પરીક્ષાનું સ્થળ અને સમય તથા કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના ૧૦ દિવસ પહેલાં મંડળની વેબસાઇટ <https://gsssb.gujarat.gov.in> પર મુકવામાં આવશે. જેની સંબંધિત દરેક ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઇટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.

(૧) કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટનો અભ્યાસક્રમ અને ગુણભાર

(અ) જા.ક. ૧૪૬/૨૦૧૮૧૯, ૧૪૮/૨૦૧૮૧૯, ૧૪૯/૨૦૧૮૧૯, ૧૫૪/૨૦૧૮૧૯, ૧૫૫/૨૦૧૮૧૯, ૧૫૭/૨૦૧૮૧૯, અને ૧૫૮/૨૦૧૮૧૯ માટે

સમય - ૧-૧૫ કલાક		
પ્રશ્ન ક્રમાંક	વિષયનું વિવરણ	ગુણ
૧	એક્સેલ સ્પ્રેડશીટ	૧૫ ગુણ
૨	ઈ-મેઇલ કરવા (વીથ ફાઇલ એટેચમેન્ટ)	૧૫ ગુણ
૩	પાવર પોઇન્ટ	૧૫ ગુણ
૪	વર્ડ ટાઇપીંગ/ વર્ડ ફોર્મેટીંગ (અંગ્રેજી તથા ગુજરાતી)	૩૦ ગુણ
	કુલ ગુણ	૭૫ ગુણ

(૨) આ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ ઓફિસ - ૨૦૧૩ ના વર્ઝન (Version) માં લેવામાં આવશે. કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટમા ગુજરાતી ભાષા માટે ફોન્ટ શ્રુતી અને માઇક્રોસોફ્ટ ઈન્ડીક લેંગ્વેજ ઈનપુટ ટુલ ૩ રહેશે. આ સોફ્ટવેરમાં નીચે મુજબનાં આઠ (૮) કી-બોર્ડ ઉપલબ્ધ છે.

1. Gujarati Transliteration
2. Gujarati Typewriter
3. Gujarati Typewriter (G)
4. Gujarati Inscript
5. Godrej Indica
6. Remigntan Indica
7. Special Characters.
8. Gujarati Terafont

(૩) વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ અને આઉટલુક (ઈ-મેઇલ) ની પરીક્ષા સોફ્ટવેર દ્વારા ખોલી આપવામાં આવેલ વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ અને આઉટલુક (ઈ-મેઇલ) માં જ આપવાની રહેશે. વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ અને આઉટલુક (ઈ-મેઇલ) પરીક્ષામાં ઉમેદવારે કોઈ ફાઇલ બનાવવાની રહેશે નહીં. એ ફાઇલ સોફ્ટવેર

દ્વારા ઓટોમેટીક બનશે. જો કોઈ ઉમેદવાર પરીક્ષાના સોફ્ટવેર સિવાય ફાઇલ ઓપન કરી લખશે તો ઉમેદવારનું પરીણામ માન્ય ગણાશે નહીં.

- (૪) ઉમેદવારને કી બોર્ડ, માઉસ, કોમ્પ્યુટર મંડળ તરફથી ઉપલબ્ધ કરવામાં આવશે. ઉમેદવારને પોતાનું કી બોર્ડ લાવવાની પરવાનગી આપવામાં આવશે નહીં. કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી શરૂ થતાં પહેલાં અને પરીક્ષા ખંડમાં પ્રવેશ્યા બાદ આપને ફાળવેલ કોમ્પ્યુટર કી બોર્ડ, માઉસ, કોમ્પ્યુટર બરાબર ચાલે છે તેની ખાત્રી કરી લેવાની રહેશે.
- (૫) કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી સમયે કોમ્પ્યુટરમાં કોઈ ટેકનીકલ ખામી જણાય તો ઉમેદવારે અન્ય ઉમેદવારને ખલેલ પહોંચાડ્યા વગર તેમજ પોતે કોઈ પગલાંઓ લીધા વગર પોતાનું સ્થાન જાળવી રાખીને (ઉભા થયા વગર) વર્ગ નિરીક્ષક (ઇન્વીજીલેટર) ને જાણ કરવાની રહેશે.
- (૬) કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટીનો સમયગાળો ૧-૧૫ કલાકનો રહેશે. ૧-૧૫ કલાક બાદ ટાઇપીંગ થવાનું આપોઆપ બંધ થઈ જશે. ૧-૧૫ કલાક પહેલાં જો ઉમેદવાર **Confirm / Accept** કરીને તેનું ટાઇપીંગ કામ સબમીટ કરી દેશે તો તેના પછી ટાઇપીંગ કામ થઈ શકશે નહીં.
- (૭) પ્રશ્નપત્રની હાર્ડકોપીના પ્રશ્ન ક્રમાંક ૧ થી ૪ અંતર્ગત તેના જવાબ માં કરવામાં આવેલ ભૂલો જેવી કે, સ્પેલીંગ / જોડણીની ભૂલ, માર્જિન સેટીંગ, ફોન્ટ સાઇઝ, ટાઇપકામ ની ભૂલ બાબતે માર્કિંગ અંગે ની કપાત, મંડળના નિર્ણય અનુસાર કરવામાં આવશે.
- (૮) આખરી પરિણામ, પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તથા બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી એમ બંને કસોટીમાં ઉમેદવારે મેળવેલ સંયુક્ત ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટમાં ઉત્તીર્ણ થવા માટે લઘુત્તમ લાયકી ગુણ (**Minimum qualifying marks**) નું ધોરણ દરેક કેટેગરી ના ઉમેદવારો માટે ૪૦% (ચાલીસ ટકા) ગુણનું નિયત થયેલ છે.
- (૯) કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટનું પરિણામ કોમ્પ્યુટર પ્રોગ્રામીંગ આધારીત હોઈ, તેના રીચેકીંગ અંગેની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.

તા. ૧૮/૦૯/૨૦૨૦

સ્થળ:- ગાંધીનગર

સચિવ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

ગાંધીનગર